

Corporate Office & Communication Address:

40I Aza House, 24, Turner Road, Bandra (W), Mumbai 400 050. Website: www.panamapetro.com
Phone: 9I-22-42I77777 I Fax: 9I-22-42I77788 I E-mail: ho@panamapetro.com
CIN No. L23209GJI982PLC005062

August 10, 2020

To,

The Manager- CRD

Bombay Stock Exchange Limited Piiroze Jeejeebhoy Towers,

Mumbai 400 001 Scrip Code: **524820** To,

The Listing Head

National Stock Exchange of India Limited,

Bandra-Kurla Complex

Bandra (E) ,Mumbai-400 051

Scrip Symbol: PANAMAPET

Sub: Newspaper clippings - Notice of Annual General Meeting and other related matters

Dear Sir,

We enclose herewith copies of the newspaper advertisement related to Notice of the Annual General Meeting and other related matters, published on August 08, 2020 in English and regional (Gujarati) newspapers.

You are requested to take the above on your records.

Thanking You.

Yours faithfully,

For PANAMA PETROCHEM LIMITED

Gayatri Sharma

Company Secretary & Compliance Officer

અમદાવાદ મંડળ ને મળ્યું ભારતીય રેલ્વેનું ભારતીય રેલ્વે દ્વારા ગુડ્ઝ ટ્રાફિકને પ્રોત્સાહન સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રીક એન્જિન આપવા વિવિધ નવી યોજનાઓની શરૂઆત



અમદાવાદ, ભારત સરકાર ની મેક ઇન ઈન્ડિયા યોજના અંતર્ગતપૂર્ણ રીતે દેશ માં બનેલું ભારતીય રેલ નું અત્યાર સુધીનું સર્વાધિક શક્તિશાળી રેલ એન્જિન WAG-12 ત્રણ દિવસ ખંડો માં કાર્ય કરશે તથા સબંધિત છે તથા લોડ પર બેકિંગ પાવર ની માટે અમદાવાદ મંડળ ને મળ્યું છે મંજરી મળ્યા પછી આને અમદાવાદ-જયાં આને સફળતા પૂર્વક ચલાવવા માટે સબંધિત સ્ટાફ ને આવશ્યક રેલખંડો પર ચલાવવામાં આવશે. પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે અમદાવાદ મંડળ ના મંડળ રેલ એન્જિન નું નિર્માણ મધેપુરા ઇલેક્ટ્રીક પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ લોકોમોટિવ પ્રા.લિ માં કરવામાં જણાવ્યુ કે માનનીય પ્રધાનમંત્રી ના આવી રહ્યું છે તથા આ 1GBT બેસ ૩ આત્મનિર્ભર ભારત ના સપના ને ફેજ ડ્રાઈવ તથા ૧૨૦૦૦ HP ની સાકાર કરતાં આ અત્યાર સુધીનું વીજળી નું એન્જિન છે જેનાથી સૌથી શક્તિશાળી રેલ એન્જિન છે જે આવનારા સમય માં પૂર ઝડપે ૧૨૦૦૦ હોર્સ પાવર નું છે તથા માલગાડીઓ દોડાવવામાં આવશે ૬૦૦૦ ટન ક્ષમતા ની માલગાડીને તથા ટ્રેક પર ટ્રેનો નું સંચાલન સુગમતા ૧૦૦ KMPH ની ક્ષમતા થી ટેક પર પર્વક કરી શકાશે તથા કાર્ગો સ્પીડ દોડી શકે છે અને આમાં હાઈરાઇજ વધશે અને રોડ ટ્રાફિક ને પુનઃ રેલ્વે પેંટો ગ્રાફ છે. વર્તમાન માં આને તરફ આકર્ષિત કરવામાં સહાયક થશે.

નિર્ધારિત કરવામાં આવ્યું છે.અત્યાર માં આ૪ રેલ એન્જિન ગેરતપુર-સુરેન્દ્રનગર તથા બોટાદ-ધોળા જં રેલ પાલનપુર તથા અમદાવાદ-ગાંધીધામ

અમદાવાદ મંડળ ના ૧૦૦ આ અત્યાધુનિક રેલ એન્જિન ના લોકોપાયલોટ અને સહાયક લોકો પરિચાલન થી ડીઝલ અને વિદેશી પણ મુક્તિ મળશે.

પાયલોટ ને ટ્રેનીગ આપવાનું લક્ષ્ય મુદ્રા ની બચત થશે તથા એર પોલ્યુશન તથા કાર્બન ફૂટપ્રિંટ બને ઓછું થઈ શકશે.ભારતીય રેલ્વે માં જ્યાં ટ્રેક પર વળાંક અને ચઢાઈ થાય જરૂરત પડે છે આ એન્જિન થી તે નિર્ભરતા સમાપ્ત થઈ જશે તથા એકલું આ પોતાની જાતે ૬૦૦૦ ટન ક્ષમતા શ્રી ઝા ના અનુસાર આ રેલ ની માલગાડી ને પરી સ્પીડ થી ચલાવવામાં સક્ષમ છે. વરિષ્ઠ મંડળ વીજળી એન્જિનિયર શ્રી એ.સુંદરેસન એ જણાવ્યુ કે ભારત દુનિયા નો છક્રો આવો દેશ જયાં આ શક્તિશાળી રેલ એન્જિન નું પરિચાલન કરવામાં આવી રહ્યું છે.આની નોર્મલ સ્પીડ ૧૦૦ KMPH છે જેને ૧૨૦ KMPH પર ચલાવી શકાય છે.આ લોકો ની લંબાઈ ૩૫ મીટર છે તથા આમાં એક હજાર લીટર હાઇ કંપ્રેશર કેપેસિટી ના બે ટેંક છે.આ રેલ એન્જિન ના આવવાથી ઘાટ સેક્શન માં બે એન્જિન લગાવવા માથી

હેઠળ ઝોનલ હેડક્વાર્ટર અને વિભાગીય કચેરીઓમાં તાજેતરમાં મલ્ટિ ડિસિપ્લિન બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્સ (બીડીયુ) ની સ્થાપના કરવામાં આવી હતી. આ એકમોને સ્થાપવાનો ઉદ્દેશ્ય નવા અનુમતિપાત્ર લોડ વહન ક્ષમતા -વિચારો અને પહેલનો સમાવેશ કરીને માલ બજારમાં માલ ટ્રાફિક સંભાવનાને વ્યવસાયની સુધારવાનો છે.રેલ્વે બોર્ડની ઓક્ટોબર ૨૦૧૯ થીર થી ૫ટન સૂચના મુજબ, પશ્ચિમ રેલ્વે હવે સુધી ઘટાડો કરવામાં આવ્યો છે, માલવાહકોને આકર્ષવા માટે પાંચ જયારે BOXNHS વેગનમાં, આ નવી પ્રોત્સાહન યોજનાઓ લાવી છે, જેના દ્વારા માલના ગ્રાહકોને તેમના માલ અને પાર્સલના પરિવહન માટે રેલ્વે સાથે જોડાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે .આ નવી પ્રોત્સાહક ૨૦૨૦થી લાગુ કરવામાં આવેલ છે. યોજનાઓની સહાયથી, ભારતીય રેલ્વે પ્રતિસ્પર્ધાત્મક એકમ દરો પર ગુડૂઝ ગ્રાહકોને ટ્રાફિક પ્રદાન કરશે, જેઓ માર્ગ પરિવહન કરતા ઘણા ઓછા છે અને આ હેઠળ, તેમના માલને ચોક્કસ સમય સાથે

ઝડપી ગતિએ ગંતવ્ય સુધી

પહોંચાડવામાં આવશે.પશ્ચિમ

અમદાવાદ, માલ ભાડાને રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી થયેલા કન્ટેનરના સંચાલન હેતુ ભાડા યોજના હેઠળ ખુલ્લા વેગનમાં ફ્લાય પ્રોત્સાહન આપવાનો ભારતીય શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ દર મુજબ રેટ પર પ% છૂટ આપવામાં રેલ્વેના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે પ્રેસ રિલીઝ અનુસાર, ગુડૂઝ આવી છે. આ છૂટ ૪ ઓગસ્ટ, પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર પ્રમોશન યોજનાઓ ગ્રાહકોને શ્રી આલોક કંસલના ઊર્જાસભર વ્યવસાય કરવાનું સરળ બનાવશે નેતત્વ અને કાર્યક્ષમ માર્ગદર્શન અને રેલ્વેને અતિરિક્ત ટાફિક અને આવક મળશે. રેલવે દ્વારા માલના પરિવહન માટે પાંચ નવીનતમ મોટી પ્રોત્સાહક યોજનાઓની વિગતો નીચે આપેલ છે –

(૧) પીઈટી કોક માટે BOXN અને BONHL વેગન્સમાં પેટ કોક લોડ કરવા માટે અનુમતિપત્ર કેરિંગ કેપેસિટી (પીસીસી) ને ૧૩ યોજના ૨૭ જૂન, ૨૦૨૦ થી લાગ થઈ. એ જ રીતે, BOXNR, BOXNCR, BOXNHSM1, BOXNM1 અને BOXNELના સંશોધિત પીસીસી ને ૫ ઓગસ્ટ, લોડિંગમાં આ છૂટ ૧૧ ઓક્ટોબર. ૨૦૨૦ સુધી માન્ય છે. આ પ્રોત્સાહક યોજના વિશે વધુ માહિતી આ લિંક પર મળી શકે છે.

https://www. indianrailways. gov.in/ railwayboard/uploads/ directorate/trafficcomm/ Freight_Rate_2020/PCC-Pet Coke.pdf

માટે પરિવહન શલ્ક પર છટઃ- ખાલી કન્ટેનર અને ખાલી ફ્લેટ વેગનની Freight_ હિલચાલ માટે ટીઇયુ મુજબ પરિવહન દર પર ૨૫% છૂટ આપવામાં આવી રહી છે. બોર્ડમાં લોડ

૨૦૨૦થી ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી લાગુ રહેશે. વિગતો નીચેની લીક ઉપરથી મેળવી શકાય છે

https://www indianrailways. gov.in/ railwayboard/uploads/ directorate/traffic_comm/ Freight_Rate_2020/Discount on loaded containers 03082020.pdf

(૩) ઔદ્યોગિક ઉપયોગ માટે મીઠાના વર્ગીકરણ - બોર્ડે ઔદ્યોગિક ઉપયોગ માટે મીઠા નું વર્ગીકરણ ઘટાડીને વર્ગ ૧૨૦ થી ૧૦૦ માં કરવાની મંજરી આપીદીધી છે.ઔદ્યોગિક ઉપયોગ માટે મીઠા ને ખુલા વેગનોમાં છૂટક કંડીશનો માં લોડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.મીઠાના છૂટક લોડિંગને તે શરત સાથે મંજુરી આપવામાં આવે છે કે રૂલોર અને સાઈડો તાડપત્રીથી કવર કરવામાં આવે જેથી મીઠાને કારણે વેગનને નુકસાન ન થાય અથવા કોરોઝેડ ન થાય.વેગનો ને આ પ્રકારની ક્ષતિ પહોંચાડવા અથવા તેમાં કોરોજન લાગવાની સ્થિતિ માં ગ્રાહકો ને આ પ્રકારનાં નુકશાન માટે ભરપાઈકરવી પડશે.સંપૂર્ણ વિગતો નીચે આપેલ લીક પર મળી શકે છે

https://www. indianrailways. gov.in/ (૨) ભરેલા કન્ટેનરની હિલચાલ railwayboard/uploads/ directorate/traffic_comm/ Rate_2020/ classification of Salt for Industrial use.pdf

(૪) માલ ભાડા કરવું પ્રોત્સાહન નીચેની લિંક પર મળી શકે છે -

એશ લોડ કરી રહ્યું છે - યુનિફોર્મ બેન્ડ સ્થિતિમાં ફ્લાય એશ લોડ કરવા માટે છટ આપવામાં આવી હતી. રેલ્વે બોર્ડ દ્વારા ફ્લાય એશ માટે ત્રણ પ્રકારના વેગન માટે છૂટક / જથ્થાબંધ લોડિંગની મંજૂરી આપવામાં આવી છે, ઉદાહરણ તરીકે, બેગ અથવા જથ્થાબંધ / છૂટક વહનની સ્થિતિ સાથે ખુલ્લા વેગન માટે વર્ગના એનટીઆર પર ૪૦% છૂટ, સમાન નિયમો મુજબ ફ્લેટ વેગન પર પેકિંગ શરત સાથે લાગુ વર્ગની એનટીઆર પર ૪૦% છૂટ અને કવર કરેલ વેગન જે બેગ એલઆર ૧ ની એનટીઆરમાં પેકિંગની શરત સાથે લેવામાં આવશે. ગ્રાહકોએ નોંધ લેવી જોઈએ કે ખુલ્લી વેગનને બલ્ક / લૂઝ લોડિંગ માટે પણ મંજૂરી છે. બેગવાળી ફ્લાય એશના કિસ્સામાં, તે પ્રમાણભૃત બેગની સમાન કદની હોવી જોઈએ અને છુટક ફ્લાય એશના કિસ્સામાં, ગ્રાહકે ફ્લાય એશને હાઇડેટ કરવાની અને વેગનને તેમના પોતાના ખર્ચે તાડપત્રી થી કવર કરવાની રહેશે . તાડપત્રી, જો ખુલ્લા વેગન્સમાં બેગવાળી ફ્લાય એશને આવરી લેવા માટે વપરાય છે. તો ગ્રાહકોએ પણ તેમના ખર્ચ ચુકવવા પડશે. ગ્રાહકે ફોરવર્ડિંગ નોટ પર બાંયધરી આપવી પડશે જેમાં જણાવ્યું હતું કે તે બેગવાળી ફ્લાય એશને ખુલ્લા અને ફ્લેટ વેગનમાં લોડ કરવા સંમતિ આપે છે અને શિપમેન્ટના નુકસાનનું સંપૂર્ણ જોખમ સહન કરશે.પ્રદ્દષણ નિયંત્રણ અંગે રાજ્ય / કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત શરતોનું ગ્રાહક કડક પાલન સુનિશ્ચિત કરશે. આ સૂચનો ૮ ઓગસ્ટ, ૨૦૨૦ થી

http://www indianrailways. gov.in/ railwayboard/uploads/ directorate/traffic_comm/

concession_03082020.pdf (૫) કન્ટેનર ટ્રાફ્રિકના કિસ્સાના શુલ્કમાં સ્ટેબલિંગ- રેલ્વે બોર્ડે રોજ વેગન દીઠ પરપ રૂપિયા લાઘા છે. સ્ટેબલીગ ચાર્જમાં છૂટ આપી છે. . ૧૮ મે, ૨૦૨૦ થી ૩૧ ઓ ક્ટોબર ૨૦૨૦ સુધી કન્ટેનર ટ્રાફ્રિકના કિસ્સામાં કોઈ સ્ટેબીલીગ શુલ્ક લેવામાં આવશે નહી. વિગતો નીચે આપેલ લીક ઉપર જોઇ શકાય છે -

Freight_Rate_ 2020/fly ash

http://www indianrailways.gov.in/ railwayboard/uploads/ directorate/traffic_comm/ Freight_ Rate_2020/Stabling charge_03082020.pdf

શ્રી ઠાકુરે માહિતી આપી હતી કે અગાઉ માલ ભાડાગ્રાહકોના લાભાર્થે ૧૪ પ્રોત્સાહક યોજનાઓ લાગ્ કરવામાં આવી હતી અને હવે આ ઉપરાંત ૫ વધુ પ્રોત્સાહક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે, જે પશ્ચિમ રેલ્વે પર નૂર ટ્રાફિક વધારવામાં ચોક્કસપશે મહત્વની ભૂમિકા નિભાવશે. મુંબઇ બાદ ગુજરાતનો વારોઃ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

વિજાપુરમાં સહકારી મંડળીમાં પોટાસમાં યુરિયાની ભેળસેળનું કૌભાંડ પકડાયું


વિજાપુર, વિપજાપુરમાં ફ્રદેડાના એક પટેલ ખેડૂતે માઢી ગામની સહકારી મંડળીમાંથી ૯૫૦ રૂપિયા આપી પોટાસ ખાતરની બેગ ખરીદી કરી હતી. જો કે, બેગ ખોલતા તેમાં યુરિયા ખાતરની ભેળસેળ હોવાની શંકા જતા ખેડૂતે કૃષિ વિભાગનો સંપર્ક કર્યો હતો. કૃષિ લગતા પ્રોડક્ટમાં ભેળસેળ ચકાસણી માટે કાર્યરત ગુણવત્તા નિયંત્રણ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં

જેમના દ્વારા તપાસ કરાતા ખાતરની બેગમાં પોટાસ સાથે યુરિયાની ભેળસેળ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. જેને પગલે ટીમ દ્વારા માઢી સહકારી જે સેમ્પલના પરિણામ બાદ નોંધાવતાં પોલીસે શરાબના ફરિયાદ કરનારા પરિવારને સરેશ મંડળીમાં જઈ વધુ તપાસ હાથ આગળની કાર્યવાહી કરવામાં ધરવામાં આવી હતી. જયાં ૨૦૦ આવશે, ત્યાં સુધી ૧૮૧ ખાતરની



હતો. જયારે ૧૯ બેગનું વેચાણ કરવામાં આવ્યું હતું. જો કે, હાલમાં તંત્રએ સ્ટોકમાં હાજર તમામ ૧૮૧ સિલ કરી ખાતરના નમુના પરીક્ષણ પૈકી ૧૮૧ ખાતરની બેગમાં સ્ટોકમાં બેગનો જથ્થો સીઝ રાખવામાં આવશે.

સાયન્સ સિટી દ્વારા હિરોશિમા દિવસ નિમિત્તે લાઈવ ટોકનું આયોજન કરવામાં આવ્યું



અમદાવાદ, ગુજરાત સાયન્સ સિટીએ સોશિયલ મીડિયા પર હિરોશિમા દિવસ ઉપર લાઈવ ટોકનું આયોજન કર્યું હતું, દ્રિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનના આ શહેરમાં હતો જેમાં ૮૦,૦૦૦થી વધુ લોકો અમેરિકા દ્વારા બોમ્બ ફેક્યાંને ૭૫ મૃત્યુ પામ્યાં હતાં અને તેના ત્રણ વર્ષ થયા હતા.

પ્રોફેસર,પારેખ બ્રધર્સ સાયન્સ ૪૦,૦૦૦થી વધુ લોકો મૃત્યું પામ્યા કોલેજ, કપડવંજ) લાઇવ ટોકમાં હતા. ડો. ભટ્ટે દુર્ઘટનાના ફાઇલ ચિત્રો બોમ્બ પાછળનું વિજ્ઞાન સમજાવતાં બતાવી બોમ્બની વિનાશક અસરોનો ફ્યુઝન અને ફિઝનની પ્રતિક્રિયાઓ ખ્યાલ આપ્યો હતો. વિસ્ફોટ એટલો સમજાવી વિચારપ્રેરક સત્રની વિશાળ હતો કે તેણે શહેરના ૯૦% શરૂઆત કરી. તેમણે ભાગ ભાગ સાફ કરી ૭૦,૦૦૦ લોકોને લેનારાઓને વિવિધ પ્રકારના તરતજમારી નાખ્યા હતા અને પછી પરમાણુ શસ્ત્રો જેવા કે પરમાણુ બોમ્બ, ટેડિએશનના સંપર્કની અસરને કારણે હાઇડોજન બોમ્બ અને સોલ્ડેડ બોમ્બ લગભગ ૧૦,૦૦૦ લોકો મૃત્યુ અને ઇલેક્ટ્રો-મેગ્નેટિક પલ્સ શસ્ત્રોથી પામ્યા હતા. સમાપન પહેલા, માહિતગાર કર્યા હતાં.

નાગાસાકી પર નાખેલા બોમ્બની ડિઝાઇન અને કામગીરી તથા તેમને હતું. –

બોય' અને 'ફેટ મેન' વિશે પણ માહિતી આપી. "લિટલ બોય" હીરોશિમા પર નાખવામાં આવ્યો દિવસ પછી(૯ ઓગસ્ટ, ૧૯૪૫), ડો .મુકેશ ભક્ટે (એસોશિએટ "ફેટ મેન" બોમ્બથી નાગાસાકીમાં પ્રોફેસર ભટ્ટે માનવજાત અને પૃથ્વીના તેમણે હિરોશિમા અને ભવિષ્ય માટે શાંતિ, પરમાણુ શસ્ત્ર મુક્ત વિશ્વનું મહત્વ પણ સમજાવ્યું

આપવામાં આવેલા કોડ નામો 'લિટલ

રંગપુર ગામે ગાયનો મૃતદેહ ઊંચકવાની ના પાડતા માતા-પુત્રને ઢોર માર માર્યો

ગાં ધીનગરના વિગતો મુજબ ગાંધીનગરના માણસા માણસા તાલુકાના એક ગામમાં તાલુકાના રંગપુર ગામમાં આ ઘટના મરેલી ગાય ઉપાડવાની ના બનીહતી. ગામના કુલદીપ પરમાર પાડનારા દલિત યુવકના ઘરમાં અને એની માતા રંજન પરમાર પર ઘુસીને એ યુવાન અને એની સુરેશ સિંહ ચાવડાએ એ લોકોના માતાને ઢોરમાર મારવાની ઘટના ઘરમાં ઘુસીને મારપીટ કરી હતી બની હતી. હુમલાખોર યુવાન અને વધુ ગંભીર પરિશામોની ધમકી બીજા દિવસે તો જામીન પર મુક્ત પણ આપી હતી.ઇન્ડિયન પીનલ પણ થઇ ગયો હતો. મારપીટનો કૉડની કલમ ૩૨૩ (શારીરિક ભોગ બનનારી મહિલા ૫૫ હુમલો કરીને ઇજા પહોંચાડવી, વર્ષની છે અને એનો પુત્ર પચીસ મારપીટ કરવી) અને ૫૦૪ વર્ષનો છે. પોલીસે જણાવ્યા મુજબ (ગુનાહિત કાવતરું કરવું)હેઠળ આ ઘટના બીજી અને ગીજી સરેશ સિંહ ચાવડા વિરુદ્ધ ફરિયાદ ઑ ગષ્ટની છે . ત્રીજી ઑ ગષ્ટે નોંધવામાં આવી હતી. ચાવડાએ આ અર્થે ગાંધીનગરની રાસાયણિક ખાતર હુ મલાનો ભો ગ બનનારાં મા- મા-દીકરાને જાતિસૂચક ગાળો પણ પરીક્ષણશાળામાં મોકલી આપેલ છે. દીકરાએ પોલીસ ફરિયાદ આપી હતી.આ કિસ્સામાં પોલીસ નશામાં ધૃત સુરેશ સિંહ ચાવડાની સિંહ ચાવડાએ જોઇ લેવાની ધમકી ધરપકડ કરી હતી. જો કે આપી હોવાનો આક્ષેપ પણ થયો ધરપકડના બીજા જ દિવસે સુરેશ હતો. હુમલાખોર યુવાન બીજા સિંહ જામીન પર મુક્ત થઇ ગયો દિવસે તો જામીન પર મુક્ત પણ થઇ ગયો હતો. મારપીટનો ભોગ પોલીસે એની સામે અનુસૂચિત બનનારી મહિલા ૫૫ વર્ષની છે જાતિ-જનજાતિ અત્યાતાર નિયંત્રણ અને એનો પુત્ર પચીસ વર્ષનો છે. ધારા હેઠળ કેસ દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ આ ઘટના માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બીજી અને ત્રીજી ઑગષ્ટની છે.

ફિક્કી અને ઓયોએ ઑનલાઇન સર્ટિફિકેશન કોર્સની સહ-રચના કરી



અમદાવાદ, હોસ્પિટાલિટી ઉદ્યોગ પર કોવિડ-૧૯ મહામારીની અસરથી હોટલ વ્યવસાયિકોના કાર્ય અને સંચાલનની રીત બદલાઇ ગઇ છે. ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રી (FICCI) અને હોટેલ તથા હોમ્સની વિશ્વની અગ્રણી ચેઇન ઓયો એક સાથે હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે ઑનલાઇન ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન કોર્સની વિકસિત અને રચના માટે (આઇટી) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આગળ આવ્યા છે. આ કોર્સ ભારત ઑનલાઇન ડિલીવરી પ્લેટફોર્મના સરકારના પર્યટન મંત્રાલય દ્વારા અમલીકરણને સક્ષમ અને સહાય જાહેર કરાયેલા ધોરણો મુજબ કરશે. ફ્રેડરેશન હોસ્પિટાલિટી સેનિટાઇઝેશન પ્રોટોકોલ્સ અને ઉદ્યોગમાં પ્રોગ્રામ વિશેની જાગતતાનં હોટેલમાં વ્યક્તિગત સંપર્કને ઓછો સર્જન પણ કરશે અને અભ્યાસક્રમ બનાવવા માટે પુનઃરચના કરવા પર પૂર્ણ થયા પર પ્રમાણપત્ર પ્રદાન કરશે. ધ્યાન કેન્દ્રિત કરશે. આ સર્ટિફિકેશન ઓયોએ કોર્સની સામગ્રીને વિકસિત કોર્સ ભારતમાં વ્યક્ગિત બજેટ, મીડ- અને ડિઝાઇન કરી છે અને પ્રોગ્રામ

વ્યવસાયિકોને સરકાર તથા ઉદ્યોગ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે તેમના સરક્ષા અને સ્વચ્છતા ધોરણોને જાળવવા અને સુધારવામાં મદદરૂપ બનશે. આ કોર્સ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.

સર્ટિફિકેશન કોર્સમાં હોટલ અને

હોસ્પિટાલિટી પ્રોફેશનલ્સને મુખ્ય સુરક્ષા દિશાનિર્દેશોને લાગૂ કરવામાં મદદ કરવા માટે નિર્મિત નવ પ્રશિક્ષણ મોડ્યુલનો એક સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ મોડ્યુલમાં હોટલ, કર્મચારી, અતિથી, ફ્રંટ-ઓફિસ, એફ એન્ડ બી સેવા, હાઉસકિપિંગ, ગેસ્ટ રૂમની સફાઇ અને ખાદ્ય ઉત્પાદનની સલાહ સામેલ છે. આમાં શંકાસ્પદ કોવિડ કે કોવિડ પોઝિટિવ અતિથીઓને સંભાળવાની રીત વિશેની સલાહનો પણ સમાવેશ થાય છે. ફિક્કી ઑનલાઇન સર્ટિફેકેશન કોર્સ માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેગમેન્ટ, બ્યુટિક હોટેલ્સ અને માટે અનુભવી પ્રશિક્ષકો પુરા પાડી હોમસ્ટેઝની સાથે સાથે હોસ્પિટાલિટી રહ્યું છે.(૧-૭)

ગાંધીનગર, મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદે જાહેર જીવન અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે. ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં આગામી દિવસોમાં જોવા મળશે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બધવારે સમીસાંજે અમદાવાદમાં ધડાકાભેર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી ૩ દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ ભારે વરસાદની આગાહી

થતા તંત્ર સજ થઈ ગયું છે. ૧ ઓગસ્ટે

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાયું

છે. જેના કારણે દક્ષિણ, મધ્ય

ગુજરાતમાં સારો વરસાદ પડવાની

આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને દ્રફઇહ્નની ટીમો પણ એલર્ટ કરી દેવામાં આવી છે.હવામાન વિભાગે

પશ્ચિમ રેલવે – અમદાવાદ કિવિઝન માળીયા રેલવે કોલોની ખાતે સ્વચ્છતા જાળવણી **ટેન્ડર નં**. ડીઆરએમ/એમડી/એડીઆઈ/માળીયા/ સેનીટેશન/13 (2020-21) **(1) કામનું નામઃ** ત્રણ વર્ષના સમયગાળા માટે હેલ્થ ઈન્સ્પેક્ટર, ધ્રાંગધ્રા હેઠળ માળીયા રેલવે કોલોની ખાતે સ્વચ્છતા જાળવણી. <mark>(2)</mark> કામની અંદાજિત કિંમતઃ ₹ 25,46,836.08/-(3) ઈએમડીઃ ₹ 50,900/- (4) પૂર્ણ કરવાનો મમયગાળોઃ 36 (છત્રીસ) મહિના **(5) ટેન્ડર જમા** કરવાની અને <mark>ખુલવાની તારીખ અને સમયઃ</mark> તા.31-08-2020 ના 15:00 કલાક સધી જમા કરાવી શકારે બને એજ દિવસે 15:30 કલાકે ટેન્ડર ખોલાશે. **(6)** વેબસાઈટઃ www.ireps.gov.in

અમને ફોલો ક્રોઃ 📂 twitter.com/WesternRly

NARMADA MACPLAST DRIP IRRIGATION SYSTEMS LIMITED CIN: L25209GJ1992PLC017791

Reg. Off: Plot No.119-120, Santej Vadsar Road, Near Alex Cable At. Santej Tl. Kalol Dist.: Gandhinagar Web Site: www.narmadadrip.com E-mail ID: narmadadrip@gmail.com

NOTICE (For the attention of Equity Shareholders) Updation of Email id:

Pursuant to the General Circular No. 20/2020 dated 5th May, 2020, issued by the Ministry of Corporate Affairs, the Company will send the annual report(s), notice(s) and other communications/benefitsonly through electronic mode to those shareholderswhose e-mail addresses are registered with the Company / Depositories. The shareholderswho have not yet registered their email address, are requested to register the same inrespect of shares held in demat form with the Depository through their DepositoryParticipant(s) and in respect of shares held in physical form by visiting on the website of Company's Registrar &Transfer Agent, M/s. PurvaSharegistry(India) Private Limited('Purva')at https://www.purvashare.com/email-andphone-updation/and upload the documents required therein.

The Shareholders are also requested to convert their physical shares into Demat, as shares of the public companies are mandated to hold in Demat form and transfer of physical shares is totally prohibited in public

For, Narmada Macpalst Drip Irrigation Systems Limited

Date: 06.08.2020 Place: Ahmedabad

Jiten Vaghasia Whole Time Director DIN: 02433557

This Notice is also available at Investor Section of the Company's website https://www.narmadadrip.com/and Corporate Announcement Section of Stock Exchange website www.bseindia.com.

લાગુ થશે. આ વિશે વધુ માહિતી

આગાહી કરી છે કે અગામી ત્રણ ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ, મધ્ય વરસાદની આગાહી કરાઇ છે.

પનામા પેટ્રોકેમ લીમીટેડ **૨જી. ઓફિસ :** પ્લોટ નં. ૩૩૦૩, જેઆઈડીસી એસ્ટેટ, અંકલેશ્વર: ૩૯૩૦૦૨ કોર્પો.ઓફિસ: ૪૦૧, અઝા હાઉસ, ૨૪ ટર્નર રોડ, મુંબઈ, ૪૦૦ ૦૫૦ વેબસાઇટ www.panamapetro.com સીન નં.: L23209GJ1982PLC005062

ફોન∘૯૧-૨૨-૪૨૧૭૭૭૭૭, ઈ-મેલ∶cs@panamapetro.com ૩૮મી વાર્ષિક સામાન્ય સભાની જાહેર નોટીસ

ખાપવામાં આવે છે કે કંપનીએ ૩૮મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ની વીડીઓ ન્ફરન્સીંગ (વીસી) અથવા બીજી તરફ ઓડીયો વિજયુઅલ મીન્સથી (ઓએવીએમ) **મંગળવાર,૮ર્મ ાપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સવારે ૧૧.૩૦ વાગે** જે કંપનીઝ અધિનિયમ, ૨૦૧૩ ની લાગુ જોગવાઈઓ અને તે જબના નિયમો, કોર્પોરેટ અફર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સામાન્ય પરિપત્ર તારીખ ૮મી એપ્રીલ ૨૦૨૦ ૩મી એપ્રીલ ૨૦૨૦ અને ૫મી મે, ૨૦૨૦ અનુક્રમે (એમસીએ પરિપત્ર)અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિય ક્ષેબીના પરિપત્ર)તારીખ ૧૨મી મે, ૨૦૨૦, કંપનીઝ એક્ટ ૨૦૧૩ની કલમ ૧૦૩ હેઠળ ૩૮મી એજીએમ્ ોટિસમાં નિર્ધારિત વ્યવસાયનો વ્યવહાર કરવા માટે શારીરીક હાજરી વિના યોજાશે.

પનીનો ૩૮મો વાર્ષિક અહેવાલની ઈ- કોપી. કંપનીની વેબસાઇટ www.panamapetro.com અને CDSL ની વેબસાઇટ www.evotingindia.com પર ઉપલબ્ધ છે.બીજી બાબતોની સાથે એજીએમર્ન નોટિસ સાથે સંપૂર્ણ વાર્ષિક અહેવાલ પણ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ જયાં કંપની ના શેર લીસ્ટેડ થે તે સ્ટોક મેક્સચેન્જની વેબસાઇટ wwww.nseindia.com અને www.bseindia.com પર ઉપલબ્ધ છે.

ાઈપણ સભ્ય જે એજીએમમાં વીસી અથવા ઓએવીએમ મારફતે હાજર હોય એમને માત્ર એજીએમ દરમ્યાન વોટીંગ સીસ્ટમથી વોટીંગ કરવાની રીત એજીએમ નોટીસમાં દર્શાવી છે

ોઈપણ સભ્ય જે એજીએમમાં વીસી અથવા ઓએવીએમ મારફતે હાજર હોય અને તે કંપનીઝ એક્ટ ૨૦૧૩ ા અધિનિયમ ૧૦૩ મુજબ તે ક્વોરમ માં ભાગ લઈ શકે છે. એજીએમ નોટિસ સાથે વાર્ષિક અહેવાલ નાણાંકીય ર્ષ ૨૦૧૯-૨૦નો અહેવાલ,તમામ સભ્યોને તેમના કંપનીના/૨જીસ્ટાર અને ટ્રાંસફર એજેન્ટ (૨જીસ્ટ્રાર)` ડીપોઝીટરી પાર્ટીસીપેટ (ડીપીએસ) પાસે નોંધાયેલા સરનામાં પર સેબી સરક્યુર મુજબ એજીએમ નોટિસ ગાર્ષિક અહેવાલની ફિઝિકલ કોપી મોકલવામાં આવ્યા છે .

ઈ-મેઇલ એડેસ અપલોડીંગ અને રજીસ્ટેશનની રીત

ો. સભ્યો જે ફ્રિઝીકલ મોડ માં શેર્સ ધરાવે છે તે કંપની ના સરનામે રજીસ્ટર્ડ નથી તે સભ્યો એમના ઈ-મેઇલ અ લીંક સાથે https://www.bigshareonline.com/ investorregistration.aspx પર અપડેટ માટે ક્લિક કરો. અથવા

ી. સભ્યો જે ડિમેટાઇઝેશન મોડમાં શેર ધરાવે છે તે એમના ઈમેઇલ એડ્સ ડિપોઝિટરી પાર્ટીસિપેન્ટ ને રજીસ્ટર અપડેટ કરવા વિનંતી કરે કે એમના ડિમેટ એકાઉન્ટ માં અપડેટ કર્યા છે.

ઈ- વોટિંગ મારફતે મતદાન કરવાની રીત

એ) એ.જી.એમની નોટિસમાં દર્શાવ્યા મુજબના ઠરાવો પર કંપની એ રિમોટ ઇવોટીંગની તેમજ એજીએમ ડરમ્યાન ઇ વોટીંગની સગવડ આપી છે એ સીસ્ટમ મારફતે ઈલેક્ટ્રોનિક્સ પધ્ધતિથી સભ્ય વોટ આપી શકશે પ્રી) જે સભ્યો ડિમેટલાઇઝડ મોડ, ફિઝિકલ મોડમાં શેર ધરાવે છે જેમેને તેમના ઈમેઇલ એડેસ રજીસ્ટર્ડ કરાવ્યા ાથી તેમને એજીએમ દર[ે]મ્યાન ઇ વોટીંગ સીસ્ટમથી વોટીંગ કરવાની રીત એજીએમ નોટીસમાં દર્શાવી છે.

આ વિગત કંપની ની વેબસાઇટ www.panamapetro.com અને CDSL ની વેબસાઇટ www.evotingindia.com પર ઉપલબ્ધ છે

સી) કોઈપણ સભ્ય જે એજીએમમાં વીસી અથવા ઓએવીએમ મારફતે હાજર હોય અને રીમોટ ઇ વોટીંગ • કર્યું હોય અને આ બાબતે પ્રતિબંધિત ના હોય તે સભ્ય એજીએમ દરમ્યાન ઈ- વોટિંગની સગવડ ઉપયોગ ડરી શકે છે.એજીએમ દરમ્યાન ઇ વોટીંગ સીસ્ટમથી વોટીંગ કરવાની રીત એજીએમ નોટીસમાં દર્શાવી છે. ડી) જે સભ્યોએ કંપની ડિપોઝિટરીપાર્ટીસિપેટીંગમાં રજીસ્ટર્ડ ના હોય તે નીચે આપેલ એજીએમની નોટીસમાં

બાપેલ નિયમોનું પાલન કરે. ઈ) વીસી/ઓએવીએમની મારફતે વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપવાની હોય તો આ સેમ પદ્ધતિથી ડિવિડન્ડની ચૂકવણી

' સભ્યો એ તેમની બેંકની માહિતી અપડેટ કરી છે તેમણે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ડિવિડન્ડની ચૂકવર્ણી કરવામાં નાવશે. પોસ્ટની કાર્યવાહી સામાન્ય થયા બાદ જે સભ્યો એ બેંકની માહિતી અપડેટ કરાવી નથી તેમને ડિવિડન્ડના મોરંટ/ ડિમાન્ડ ડાફ્ટ તેમના નોંધાયેલા સરનામાં પર મોકલી આપવામાં આવશે.

ડેવવિડન્ડની ચૂકવર્ણી ડિરેક્શન ઓફ ટેક્સ ઓફ સોર્સ (ટીડીએસ)ની કપાત જે દર લાગુ પડતા હશે તે પ્રમાણે યશે ટીડીએસ બાબતે. સભ્યોને વિનંતી છે કે તેમની વ્યક્તિગત હોદ્દાની માહિતી. અપડેટ કરે જેમકે પાન કાર્ડ બાઈટી કાયદા મજબ તેમના ડીપીએસ. અથવા ક્રિજિક્લ શેર ધરાવતા હોય તેમને વેબસાઇટ https:// vww.bigshareonline.com/ investorregistration.aspx પર ક્લીક કરીને નોંધાવાનું હેશે. વધારે માહિતી માટે એજીએમની નોટિસમાં આપેલી વિગતો તપાસો.

ડિવિન્ડન્ડ મળી ગયાની નોંધણીં પદ્ધતિ

સભ્યો ને વિનંતી કે તેઓ તેમના નોંધાયેલી બેંક ડિટેઇલ અપડેટ કરે.

ાઇક્રો વિગત , સેલ્ફ એટેસ્ટેડ પાન કાર્ડની કોપી, કેન્સલ ચેક.

. જો શેર ડીમેટાઇઝેશન ધરાવતા હોય અને તેવા ડિપોઝિટરી પાર્ટીસિપેટ સાથે ડિમેટ એકાઉન્ટ મેળવી લે. આરટીએ https://www.bigshareonline.com/ investorregistration.aspx પર રીઝિકલ પદ્ધતિ માં શેર હોય તો ક્લીક કરો. અને સહી કરેલી સ્કેન કોપી સબ્મીટ કરવાની વિનંતી પત્ર મ

ભ્યોને વિનંતી કે તમામ નોંધ ચોક્સાઈથી વાંચે છે તે એજીએમની નોટિસમાં આપી છે. જેમા એજીએમ ઈ વોટિંગ કે રિમોટ ઈ- વોટિંગ કરવાની પદ્ધતી માં જોડાવા માટે ના રીતની બાબતો ધ્યાનથી વાંચો

ભ્યનું નામ , ફોલીયો નંબર, બેંક માહિતી (બેંક એકાઉન્ટ નંબર, બ્રાન્ચનું નામ, સરનામું આઈએફસી કોડ

પનામા પેટ્રોકેમ લીમીટેડ વતી ગાયત્રી શર્મો

તારીખઃ ૦૭ ઓગસ્ટ, ૨૦૨૦

કંપની સેક્રેટરી અને કમ્પ્લાંયસ ઓફિસર



EQUITAS SMALL FINANCE BANK LTD Corporate Office: No.769, Spencer Plaza, 4th Floor, Phase-II,

Anna Salai, Chennai, TN - 600 002

POSSESSION NOTICE

(U/s. Rule 8 (1) - for immovable property)

Whereas the undersigned being the Authorized Officer of M/s. Equitas Small Finance Bank Limited, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act. 2002 (54 of 2002)] and in exercise of powers conferred under section 13(12) read with [Rule 3] of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice calling upon the below mentioned Borrowers in Loan Account to repay the total outstanding amount mentioned in the notice being within 60 days from the date of receipt of the said notice. Since the below mentioned Borrowers having failed to repay the below stated amount within the stipulated time, notice is hereby given to the below mentioned borrowers and the public in general that, the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the said Act read with Rule 8 of the Security interest Enforcement Rules, 2002. The Borrowers in particular and the public in general are hereby cautioned not to deal with the schedule mentioned properties and any dealings with the properties will be subject to the charge of M/s. Equitas Small Finance Bank Limited and further interest and other charges thereon. "The Borrower's attention is invited to provisions of sub -section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

Name of the Borrower(s) / Guarantor(s)	Description of Secured Asset Demand N (Immovable Property) Date & Am		Date of Possession
Branch: Mehsana LAN No: SEMEHSN0142140 Borrower: Mr. Natvarlal Punamchand Lavar, S/o. Punamchand Lavar, Co-Borrowers: 1. Mr. Milap Natvarlal Luhar, S/o. Natvarlal Luhar, 2. Mrs. Nirmalaben Milapbhai Luhar, W/o. Milapbhai Luhar, 3. Mr. Vijaykumar Natvarlal Luhar, S/o. Natvarlal Luhar	The Plot No. 35 of Bahuehar Society which is situated in Survey No.412 of Visnagar sim, Ta. Visnagar Dist. Mehsana in built up area 34.42.50 Sq.Mts.and adj. marginal land 44.32.50 Sq.Mts. Land with the boundaries as	Rs.5,60,199/- & as on 30.10.2019	05.08.2020

Sd/- Authorised Officer. Equitas Small Finance Bank

For Electrotherm (India) Limited

Fageshkumar R. Soni

Company Secretary



Place: Mehsana

ELECTROTHERM (INDIA) LTD.

Regd. Office: A-1, Skylark Apartment, Satellite Road, Satellite, Ahmedabad - 380 015 CIN: L29249GJ1986PLC009126 Website: www.electrotherm.com Email: sec@electrotherm.com Phone: +91-79-26768844, Fax: +91-79-26768855

ADDENDUM TO THE NOTICE OF 34™ ANNUAL GENERAL MEETING

This is with reference to the Notice dated 30th June, 2020 sent to the members for convening 34th Annual General Meeting ("AGM") on Monday, 17" August, 2020 at 10:00 a.m. through Video Conferencing / Other Audio Visual Means (VC/OAVM). The AGM Notice and the Annual Report has already been sent to all the Members whose e-mail addresses are registered with the Company / Depository Participants (DP) / Registrar & Share Transfer Agent (RTA) in compliance with the provisions of the Companies Act, 2013 ("the Act") read with the Rules made thereunder and MCA Circulars dated 8th April, 2020, 13th April, 2020 and 5th May, 2020 and SEBI Circular dated 12th May, 2020.

Subsequent to the issuance of the AGM Notice, the Company has, on 31" July, 2020, received one notice under Section 160 of the Act along with deposit of Rs. 1,00,000/- (Rupees One Lac Only) from Mr. Aditya Jain (DIN: 01568183) Signifying his candidature as a Director of the Company in category of Non-Executive Director at the ensuing 34" AGM. Accordingly, pursuant to Section 160(2) of the Act read with Rule 13 of the Companies (Appointment and Qualification of Directors) Rules, 2014, the Company is required to inform the members about the above referred candidature and the notice of 34" AGM is amended by adding additional agenda Item No. 7 for appointment of Mr. Aditya Jain as an Non-Executive Director of the Company.

The said addendum to the AGM Notice for additional Agenda Item No. 7 along with explanatory statement is available at the section of Investor Relations of the Company's website at www.electrotherm.com and can also be downloaded from the same. This addendum to the AGM Notice shall form an integral part of notice dated 30th June, 2020 circulated to the Members of the Company.

The Company shall take necessary action for updating the aforesaid Addendum to the AGM Notice on the website of (i) the BSE Limited (BSE) at www.bseindia.com and National Stock Exchange of India Limited (NSE) at www.nseindia.com, and (ii) Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com for their information and necessary action. Members and other stakeholders are requested to read the AGM Notice along with this addendum.

This Notice would also available at corporate announcement of Stock Exchange website www.bseindia.com and

Del)

Muthoot Homefin

Place: Palodia Date: 7" August, 2020

Muthoot Homefin (India) Ltd.

Corporate Office: 1201 & 1202, 12th Floor, 'A' Wing, Lotus Corporate Park, Off. Western Express Highway, Goregaon (East), Mumbai - 400 063.

POSSESSION NOTICE (As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of Muthoot Homefin (India) Ltd. (MHIL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken symbolic / physical possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Muthoot Homefin (India) Ltd. for an amount as mentioned herein under with interest thereon.

Sr. No.		Description of secured assets (immovable property)	Date of Demand Notice & Total Outstanding Dues (Rs.)	Date of Possession	
1.	Dinesh Babulal Bhargava / Komal Dinesh Bhargava / 004-00403783 / Surat	A - 302, Hari Darshan Residency - A, Sai Darshan Residency, Wing - A, Bagumara, Palsana, Surat, Gujarat- 394327	09-11-2019 / Rs. 8,94,864/- (Rupees Eight Lac Ninety Four Thousand Eight Hundred Sixty Four Only)	Symbolic possession Taken On Dtd 05-08-2020	
2.	Saroj Sobhit Mandal / Rajesh Sobhit Mandal / 004-00000434 / Surat	Plot No. 493, Sai Deep Residency 2, Block No. 88/P, 101,102, Jolwa, Near Aaradhana Industrial Estate, Palsana, Dist-Surat, Gujarat-394327	13-01-2020 / Rs. 12,00,395/ (Rupees Twelve Lac Three Hundred Ninety Five Only)	Symbolic possession Taken On Dtd 05-08-2020	
3.	Vinod Murlidhar Patil / Raja Murlidhar Patil / Bebi Murlidhar Patil / 004-00403369 / Surat	Plot No 459,Sai Angan Resi,Nr Aaradhana Industrial Off Surat Bardoli Rd Jolwa Palsana Surat Gujrat-394305	13-01-2020 / Rs. 10,91,040/- (Rupees Ten Lac Ninety One Thousand Forty Only)	Symbolic possession Taken On Dtd 05-08-2020	
4.	Jitendra Karan Singh / Santrani Karan Singh / 004-00405354 / Surat	Flat No 402,4Th Floor, Om Sai Residency, Off Surat Bardoli Highway, Bagumara, Palsana Surat Gujarat-394327	07-02-2020 / Rs. 6,37,958/- (Rupee Six Lac Thirty-seven Thousand Nine Hundred Fifty-Eight Only)	Symbolic possession Taken On Dtd 05-08-2020	
5.	Sunil Gokulbhai Parmar / Miraben Gokulbhai Parmar / 004-00000164 / Surat 102, Aradhana Dream Vibhag-4 Kadodara Bardoli Road, Jolva, Gran Panchayat Surat Gujarat-394305		07-02-2020 / Rs. 5,56,341 (Rupee Five Lac Fifty-six Thousand Three Hundred Fourty one Only)	Symbolic possession Taken On Dtd 05-08-2020	
6.	Amarjeetkumar Sudhir Saw / Pujakumari Surendra Sah / 004-00405759 / Surat	Flat No.B-310,3Rd Floor,Yogi Palace, Wing-B,Yogidarshan Society, Surat-Mumbai Highway, Palsna, Surat, Gujarat-394315	26-09-2019 / Rs. 7,73,049/- (Rupees Seven Lac Seventy Three Thousand Forty Nine Only)	Symbolic possession Taken On Dtd 06-08-2020	
7.	Kuldip Suryakant Singh / Mamat Kuldip Singh / 004-00406000 / Surat	Flat No-B-410, 4th Floor, Yogi Palace, Wing-B, Yogidarshan Society, Surat-Mumbai Highway, Palsana, Surat, Gujarat-394315	26-11-2019 / Rs. 8,00,120/- (Rupees Eight Lac One Hundred Twenty Only)	Symbolic possession Taken On Dtd 06-08-2020	
8.			13-01-2020 / Rs. 10,02,769/- (Rupees Ten Lac Two Thousand Seven Hundred Sixty Nine Only)	Symbolic possession Taken On Dtd: 06-08-2020	

FINANCIAL EXPRESS

GANESH HOUSING CORPORATION LIMITED [CIN: L45200GJ1991PLC015817]

Registered Office: Ganesh Corporate House, 100 Feet Hebatpur-Thaltej Road Near Sola Bridge, Off S. G. Highway, Ahmedabad 380054, India P: +91 79 61608888 • F: +91 79 61608899 W: www.ganeshhousing.com • E: investors@ganeshhousing.com

NOTICE

NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Friday, 14th August, 2020 at the Registered Office of the Company, inter alia, to consider the Unaudited Financial Results of the Company for the quarter ended 30th June, 2020.

The above intimation is available on the Company's website i.e. www.ganeshhousing.com and also on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com.

DATE: 07/08/2020 PLACE: AHMEDABAD For GANESH HOUSING CORPORATION LIMITED PRITI KAPADIA

OSBI

STATE BANK OF INDIA STRESSED ASSETS MANAGEMENT BRANCH "Red Cross Buildings", 32, Red Cross Road, Egmore, Chennal-600 008 Ph: 044 - 2888 1003 / 1022, E-mail: sbi.04105@sbi.co.in

POSSESSION NOTICE (RULE-8 (1))

Whereas The undersigned being the Authorised Officer of the State Bank of India under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (No.3 of 2002) and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 19.02.2020 calling upon the Borrower M/s Nakoda Unique Gold Private Ltd and the Guarantors Shri.Ramanlal Jain, Shri.Goutham Kumar Jain, Smt.Bharti Devi, Smt.G.Sangita to repay the amount mentioned in the notice being Rs.34,69,55,034.73 (Rupees Thirty Four Crores Sixty Nine Lakhs Fifty Five Thousand and Thirty Four and Paise Seventy Three Only) as on 19.02.2020 and interest from 01.01.2020 within 60 days from the date of receipt of the said

The borrower having failed to repay the entire dues to the Bank, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 4th day of August of the

The borrower/guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the State Bank of India for an amount of Rs.33,61,92,838.14 (Rupees Thirty Three Crores Sixty One Lakhs Ninety Two Thousand Eight Hundred and Thirty Eight and Paise Fourteen Only) and further interest from 01.07.2020, costs, etc., thereon.

The borrowers attention is invited to provisions of Sub-section(8) of Section 13 of the Act in respect of time available to redeem the secured assets.

DESCRIPTION OF PROPERTY Property in the name of Shri Ramanlal Jain - Green Acres, Ahmedabad

All that undivided proportionate share in the piece or parcel of N.A land situated, lying and being at Mouje: Vejalpur, Tal: Ahmedabad City West bearing Revenue Survey No.781 /1, 781/2, 781/3, 780, 941/1, 924/3, 941/2, 941/3, 943 and 945 which was comprised in Town Planning Scheme No.25 (Vejalpur) and given Final Plot No.71, 83, 84, 63, 80, 38/2, 70, 67, 69, 64 and 82 together with Flat No.A-3/503 on Fifth Floor, admeasuring 127.65 sq.mts (Built-up Area) together with proportionate common area admeasuring 62.87 sq.mts in a scheme known as "Green Acres" in the Registration District, Ahmedabad and Sub District, Ahmedabad-10 (Vejalpur). Boundaries: On the North by Flat No.502, On the South by Passage Area (Road of Building), On the East by Block A2 and Car parking, On the West by Flat No.504.

Date: 04.08.2020 Authorised Officer Place: Ahmedabac







arrive at a conclusion not an assumption. nform your opinion detailed analysis



or the Indian Intelli he Indian Express.

55EC

PLACE: AHMEDABAD

DATE: 7" August, 2020

GSEC LIMITED

Regd. Office: Gujarat Chambers Building, Ashram Road, Ahmedabad - 380009 CIN: U52100GJ1965PLC001347 Ph. No.: 079-26575757 E-Mail: cs@gsecl.co.in, Website: www.gsecl.co.in

NOTICE

Notice is hereby published pursuant to the provisions of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("The IEPF Rules") as amended from time to time. The IEPF Rules, amongst other matters, contain provisions for transfer of all shares in respect of which dividend has not been paid or claimed by the Shareholders for seven consecutive years or more in the name of Investor Education Protection Fund Authority ("IEPF Authority").

Accordingly, the Company had during the financial year 2019-20, transferred to the Demat account of the IEPF Authority all such shares in respect of which dividend had remained unpaid or unclaimed for seven consecutive years or more as on the due date of transfer. The Company has communicated individually to the concerned shareholders at their registered address whose shares are now due for transfer in the month of November, 2020 to IEPF Authority and the full details of which are available on the website of the Company.

In case the Company or the Registrar and Share Transfer Agenda does not receive any valid claim from the concerned shareholder, the Company with a view to comply with the requirements as set out in the IEPF Rules, will transfer the shares to the IEPF Authority without any further notice, by due date as per procedure stipulated in IEPF Rules with a view to complying with the said Rules.

The Shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF Authority, may note that the Company would be issuing New Share Certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of the transfer of shares to IEPF Authority as per the IEPF Rules and upon such issue, the original share certificate(s) which stand registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable. In case the shares are held in Demat mode the Company shall inform the depository by way of corporate action for transfer of shares lying in their demat account in favour of demat account of IEPF Authority.

The Shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of the New Share Certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the IEPF Rules.

Shareholders are requested to note that both the unclaimed dividend and the shares transferred to IEPF Authority including all benefits on such shares, if any, can be claimed back by them from IEPF Authority after following the procedure prescribed by

For any clarification on the matter, please contact the Company's Registrar and Transfer Agents: M/s. Bigshare Services Private Limited at its office A-802, Samudra Complex, Near Girish Cold Drinks, Off C. G. Road, Navrangpura, Ahmedabad 380009 Tel: 079 40392571, Email: bssahd1@bigshareonline.com; Website: www.bigshareonline.com.

FOR GSEC LIMITED

Sd/-**RAKESH SHAH**

CHAIRMAN AND MANAGING DIRECTOR



NCLT, Bench at Ahmedabad, the name of the aforesaid Company is hereby restored as M/s. Panchamrut Infrastructure Private Limited, in the office of Register maintained by the office of Companies, Gujarat.

Place: Ahmedabad

Date: 08/08/2020

COMPANIES ACT, 2013.

SOLANKI & OTHERS.

PARVATIBEN KAMLESHBHAI SOLANKI

Name of the Director DIN 07691388

PANAMA PETROCHEM LIMITED Regd. Office: Plot No.-3303, GIDC Estate, Ankleshwar, Gujrat - 393002.

NOTICE

IN THE MATTER OF COMPANIES ACT, 2013

AND

IN COMPANY APPEAL N O 315/252(3)/NCLT/AHD/2020

REGARDING RESTORATION OF THE NAME OF THE

COMPANY M/S. PANCHAMRUT INFRASTRUCTURE

PRIVATE LIMITED UNDER SECTION 252 OF THE

IN THE MATTER OF KAMLESHKUMAR GANPATBHAI

V/S REGISTRAR OF COMPANIES, AHMEDABAD, GUJARAT.

Notice is hereby issued that the Hon'ble NCLT of Gujarat vide order

dated 17/03/2020 passed in Company Appeal No.

315/252(3)AHD/2019 directed for restoration of the above named

Company namely M/s. Panchamrut Infrastructure Private Limited, in the Register of Companies maintained by the office of the

Registrar of Companies, Gujarat. As per the said order of the Hon'ble

Corp. Office: 401, Aza House, 24, Turner Road, Bandra (W), Mumbai - 400 050. Website: www.panamapetro.com CIN no.: L23209G31982PLC005062 Phone: 91-22-42177777, E-mail: cs@panamapetro.com

PUBLIC NOTICE: 38th ANNUAL GENERAL MEETING Notice is hereby given that the 38* Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Tuesday, September 8, 2020 at 11:30 A.M. IST through Video Conference ('VC') / Other Audio Visual Means ('OAVM') in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the rules made thereunder, read with General Circular dated April 8, 2020, General Circular dated April 13, 2020, General Circular dated May 5, 2020 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Circular dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India ('SEBI Circular'). Members participating through the VC / OAVM facility shall be reckoned for the purpose of

guorum under Section 103 of the Companies Act, 2013. The e-copy of 38th Annual Report of the Company will be available on the website of the Company at www.panamapetro.com and on the website of CDSL at www.evotingindia.com Additionally, the Notice of AGM along with the complete Annual Report will also be available on the websites of the stock exchanges on which the securities of the

Company are listed i.e. at www.nseindia.com and www.bseindia.com Members can attend and participate in the AGM through the VC/OAVM facility ONLY, the

Members attending the Meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Notice of the AGM along with the Annual Report 2019-20 will be sent electronically to those Members whose e-mail addresses are registered with the Company / Registrar & Transfer Agents ('Registrar') / Depository Participants ('DPs'). As per the SEBI Circular, no physical copies of the Notice of AGM and Annual Report will be sent to any Member.

details of which will be provided by the Company in the Notice of the Meeting.

Manner of registering / updating email addresses:

(a) Members holding shares in physical mode, who have not registered / updated their email addresses with the Company, are requested to register / update the same by clicking on https://www.bigshareonline.com//investorRegistration.aspx.or

(b) Members holding shares in dematerialised mode, who have not registered / updated their email addresses with their Depository Participants, are requested to register update their email addresses with the Depository Participants with whom they maintain their demat accounts.

Manner of casting vote(s) through e-voting:

(a) Members will have an opportunity to cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting").

(b) The manner of voting remotely ("remote e-voting") by members holding shares in

dematerialised mode, physical mode and for members who have not registered their

email addresses has been provided in the Notice of the AGM. The details will also be available on the website of the Company at www.panamapetro.com and on the website of CDSL at www.evotingindia.com.

c) The facility for voting through electronic voting system will also be made available at the AGM and Members attending the AGM who have not cast their vote(s) by remote

e-voting will be able to vote at the AGM. d) Members whose email addresses are not registered with the Company /Depository Participant(s), may generate login credentials by following instructions given in the

Notes to Notice of AGM. (e) The same login credentials may also be used for attending the AGM through

VC/OAVM. Dividend Payment

Payment of dividend shall be made through electronic mode to the members who have updated their bank account details. Dividend warrants / demand drafts will be dispatched to the registered address of the members who have not updated their bank account details, after normalisation of the postal service.

Payment of dividend will be subject to deduction of tax at source (TDS) at applicable rates. In general, to enable compliance with TDS requirements, Members are requested to complete and / or update their Residential Status, PAN, Category as per the IT Act with their DPs or in case shares are held in physical form with the Registrar by clicking https://www.bigshareonline.com//InvestorRegistration.aspx. For more details, please refer to the Notes to the Notice of AGM.

Manner of registering mandate for receiving Dividend:

Members are requested to register / update their complete bank details:

(a) with their Depository Participant(s) with whom they maintain their demat accounts, if shares are held in dematerialised or

(b) with the RTA by clicking on https://www.bigshareonline.com//InvestorRegistration.aspx if shares are held in physical mode, by submitting (i) scanned copy of the signed request letter which shall contain member's name, folio number, bank details (Bank account number, Bank and Branch Name and address, IFSC, MICR details), (ii) self-attested copy of the PAN card and (iii) cancelled cheque leaf.

Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or e-voting during the AGM.

For PANAMA PETROCHEM LIMITED

Place: Mumbal Date: 07 August 2020

Geyetri Sherma Company Secretary & Compliance Officer



Central Bank of India Regional Office: 1st Floor, Nariman Abad, Athugar Street, Nanpura, Surat-395001. Phone: 0261-2465841, 2465842

E-AUCTION SALE NOTICE (UNDER SARFAESI ACT 2002)

Ahmedabad

DIN: 00421920

APPENDIX-IV -A SEE PROVISO TO RULE 8 (6) SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY ON 17.09.2020

E-auction Sale Notice For Sale of Immovable Assets Under Securitisation And Reconstruction of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 Read With Proviso To Rule 8(6) Of The Security Interest (enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged charged to the Secured Creditor the Physical Possession of which has been taken by the Authorized Officer of Central Bank of India, will be sold on "AS IS" WHERE IS", "AS IS WHAT IS" AND "WHATEVER THERE IS" BASIS on 17.09.2020, through online portal: https://mstcecommerce.com/ auctionhome/ibapi/index.jsp, for recovery of amount due to secured creditor bank. The Reserve Price & EMD and other details are in below table. For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditor's web site www.centralbankofindia.co.in

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Sr. No.	Name of the Borrower/ Guarantor	Date & Amount of Demand Notice	Description of immovable property	Date & Type of Possession	Reserve Price Rs./ EMD Rs./ Bid increase Amoun
1.	M/s. Jayaraj Textiles, Through its's Proprietor: Mr. Paraskumar Narsangbhai Rathod (Proprietor) Mr. Popatbhai Shamjibhai Italia (Guarantor) Mr. Rameshbhai Bhikhabhai Rathod (Guarantor) Mrs. Sajanben Rameshbhai Rathod (Guarantor) Mr. Dhirubhai Bhikhabhai Rathod (Guarantor)	as on 28.02.2019	A Type Plot no. 23 paikee Sub-Plot no. 67 to 70 (As per Village form no.7/12), each sub plot adm. 117.00 sq.mtrs and Adj. Land adm. 33.03 sq.mtrs. with proportionate undivided inchoate share of Road and COP Land in Om Textile Park Vibhag-2 with all appurtenances pertaining thereto, standing on land bearing block no.187 lying, being and situated at Village- Parab, Tal-Kamrej, Distt- Surat, Subdistt- Kamrej in the name of Mrs. Sajanben Rameshbhai Rathod	Physical Possession	Rs. 1,55,00,000/- Rs. 15,55,000/- Rs. 1,00,000/-
2.	M/s. Ramdev Textiles , Through its's Proprietor : Mr. Rameshbhai Bhikhabhai Rathod (Proprietor) Mrs. Sajanben Rameshbhai Rathod (Guarantor) Mr. Popatbhai Shamjibhai Italia (Guarantor) Mr. Paraskumar Narsangbhai Rathod (Guarantor) Mr. Dhirubhai Bhikhabhai Rathod (Guarantor)	Rs. 98,65,245.68 as on 31.12.2018 + Further interest thereon			
3.	M/s. Amjiba Textiles, Through its's Proprietor: Mrs. Sajanben Rameshbhai Rathod (Proprietor) Mr. Popatbhai Shamjibhai Italia (Guarantor) Mr. Rameshbhai Bhikhabhai Rathod (Guarantor) Mr. Dhirubhai Bhikhabhai Rathod (Guarantor) Mr. Paraskumar Narsangbhai Rathod (Guarantor)	Rs. 90,28,919.46 as on 31.12.2018 + Further interest thereon			

Date & time of Inspection: 10.09.2020 between 12.00 pm to 3.00 p.m.

 Date & time of E-Auction: 17.09.2020 between 11.00 am to 2.00 pm. (With auto extension clause in case of bid in last 10 minutes before closing) Last date for online Bid and EMD Amount: 16.09.2020 up to 4.00 p.m.

Details of Encumbrances over the property as known the Bank: Not Known.

For participating in the e-auction sale, the intending bidders should register their details with the service provider https://mstcecommerce.com/

auctionhome/ibapi/index.jsp well in advance and shall get user ID and password. Intending bidders advised to change only the password. Bidders may visit https://mstcecommerce.com/ auctionhome/ibapi/index.jsp for bidders are available with educational videos. For detailed terms & conditions of sale, please refer to the link provided bank's website: www.centralbankofindia.co.in Bidder will be register on website: https://mstcecommerce.com/ auctionhome/ibapi/index.jsp and upload KYC documents and after verification of KYC

documents by the service provider. EMD to be deposited in Global EMD wallet through NEFT / transfer (after generation of Challan from https://mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp) For the further details contact Central Bank of India, Bhatar Road Branch: Shri R. P. Singh, Chief Manger, (M): 7567883863 & Regional Office, Surat

Mr. Sanjay Kumar (M). +91-9687690060 & Mr. Dharmendra Kumar (Chief Manager) M.: 6359895003.

The Terms and conditions shall be strictly as per the provisions of the security interest Rules (Enforcement) Rules, 2002.

STATUTORY 30 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002

Borrowers/Gurantors/Mortgagers are hereby notified for sale of immovable secured assets towards realization of outstanding dues of secured creditors. **AUTHORISED OFFICER** Place: Surat Central Bank Of India Date : 07.08.2020

सेन्ट्रल जेंड ओइ छन्डिया सेन्ट्रल बैंक ऑफ़ इंडिया Central Bank of India

Date: 08.08.2020

BRANCH MANDAVAD:

Landline No.: 02873-2222259.

Mail: bmrajk4746@centralbank.co.in

E-AUCTION / SALE NOTICE

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] Sale Notice for Sale of Immovable Properties on 28.07.2020 E-Auction Sale Notice for Sale of Immovable Assets under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002

Authorized Officer, For Muthoot Homefin (India) Limited

read with proviso to rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) that the below described immovable property mortgaged / charged to the secured creditor, the Symbolic Possession of which have been taken by the authorized officer of Central Bank of India, Secured creditors, will be sold on "As is Where is", 'As is What is" and "Whatever is There is" basis on 11/09/2020 for recovery of due to the Central Bank of India from Borrower(s) and Guarantor(s). The Reserve Price an

		ESCRIPTION OF THE	E IMMOVABLE	PROPERTIES		
SR. No.	Name of the Borrower / Guarantor/ Mortgagor	Branch Contact Details	Demand Notice Date & Due Amount	Description Of The Immovable Properties	Reserve Price & EMD 10%	
1.		Mr. Madan Gopal Darji	20/03/2019	"Vishal Motors" (Showroom of Hero)		
	Borrowers : Mr. Babubhai Kanubhai Ribadiya,	Mandavad Branch Mob. : 84690 48457	Mob. : 84690 48457 + Interest + Other Charges	Plot No. 1, paikee & Plot No. 2 (Commercial part), R. S. No. 93/1/P, Visavadar - Junagadh	99.91,999	
1	Mr. Bharatbhai Kanubhai Ribadiya Mr. Rahul Sureshbhai Ribadiya			Road, At - Village: Mandavad, Tal.: Visavadar, Distt: Junagadh)		
	Mrs. Rasilaben Bharatbhai Ribadiya Authorised Officer, Mrs. Champaben Babubhai Ribadiya Mr. Anil Kumar	thereon	Plot No.1 (Residential Part), R. S. No. 93/1/P,			
Mr. Valla	Guarantor:	Junagadh Branch Mob. : 96876 90005	bh Keshavdas Hirpara Mob. : 96876 90005		B/h. Vishal Motors (Honda Showroom),	28,23,000
	Mr. Vallabh Keshavdas Hirpara Mr. Chirag Raghavjibhai Patel				Visavadar - Junagadh Road, At-Village : Mandavad, Tal. : Visavadar, Distt. : Junagadh)	2,82,300

Date of E-Auction: 11/09/2020 • Time - 12.00 NOON to 2.00 PM with Auto extension of 10 Minutes. Date of Inspection & Time: 07.09.2020 Between 12.00 Noon to 3.00 PM

Last Date & Time of Submission of EMD and Documents (Online) On or Before: 10.09.2020, Up to 4.00 PM.

Bidder will register on website https://www.mstcecommerce.com and upload KYC documents and after verification of

KYC documents by the service provider, EMD to Be Deposited In Global EMD wallet through NEFT/RTGS/transfer (after generation of challan from https://www.mstcecommerce.com)

The auction will be conducted through the Bank's approved service provider "https://www.mstcecommerce.com" E - Auction will be held "As is where is", "As is what is" and "whatever is there is" basis. For detailed terms and conditions please refer to the link provided in www.centralbankofindia.co.in secured creditor or or auction platform {https://mstoecommerce.com}. MSTC Helpline No.: 033-22901004 and also at Mandavad Branch, Branch Manager Contact No. M. 84690 48457

STATUTORY 30 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002 Borrowers/Guarantors/ Mortgagors are hereby notified to pay the sum as mentioned above along with up to date interest and ancillary expenses before

the date of e-auction, failing which the property will be auctioned/sold and balance dues, if any, will be recovered with interest and cost. Sd/- Authorised Officer, Date: 07.08.2020, Place: Mandavad, Junagadh Central Bank of India

financialexp.epapr.in



Regd. Office: Plot No.-3303, GIDC Estate, Ankleshwar, Gujrat - 393002. Corp. Office: 401, Aza House, 24, Turner Road, Bandra (W), Mumbai - 400 050.

Website: www.panamapetro.com CIN no.: L23209GJ1982PLC005062 Phone: 91-22-42177777, E-mail: cs@panamapetro.com

PUBLIC NOTICE: 38th ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 38th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Tuesday, September 8, 2020 at 11:30 A.M. IST through Video Conference ('VC') / Other Audio Visual Means ('OAVM') in compliance with the applicable provisions of the Companies Act. 2013 and the rules made thereunder, read with General . Circular dated April 8, 2020, General Circular dated April 13, 2020, General Circular dated May 5, 2020 issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Circular dated May 12, 2020 issued by the Securities and Exchange Board of India ('SEBI Circular'). Members participating through the VC / OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

The e-copy of 38th Annual Report of the Company will be available on the website of the Company at www.panamapetro.com and on the website of CDSL at www.evotingindia.com. Additionally, the Notice of AGM along with the complete Annual Report will also be available on the websites of the stock exchanges on which the securities of the

Company are listed i.e. at www.nseindia.com and www.bseindia.com Members can attend and participate in the AGM through the VC/OAVM facility ONLY, the details of which will be provided by the Company in the Notice of the Meeting.

Members attending the Meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Notice of the AGM along with the Annual Report 2019-20 will be sent electronically to those Members whose e-mail addresses are registered with the Company / Registrar & Transfer Agents ('Registrar') / Depository Participants ('DPs'). As per the SEBI Circular, no physical copies of the Notice of AGM and Annual Report will be sent to any Member.

Manner of registering / updating email addresses:

- (a) Members holding shares in physical mode, who have not registered / updated their email addresses with the Company, are requested to register / update the same by clicking on https://www.bigshareonline.com//InvestorRegistration.aspx or (b) Members holding shares in dematerialised mode, who have not registered / updated
- their email addresses with their Depository Participants, are requested to register / update their email addresses with the Depository Participants with whom they maintain their demat accounts. Manner of casting vote(s) through e-voting:

(a) Members will have an opportunity to cast their vote(s) on the business as set out in the

- Notice of the AGM through electronic voting system ("e-voting"). (b) The manner of voting remotely ("remote e-voting") by members holding shares in
- dematerialised mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the AGM. The details will also be available on the website of the Company at www.panamapetro.com
- and on the website of CDSL at www.evotingindia.com. (c) The facility for voting through electronic voting system will also be made available at the
- AGM and Members attending the AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM. (d) Members whose email addresses are not registered with the Company /Depository Participant(s), may generate login credentials by following instructions given in the
- Notes to Notice of AGM. (e) The same login credentials may also be used for attending the AGM through
- VC/OAVM. **Dividend Payment**

Date: 07 August 2020

normalisation of the postal service.

Payment of dividend shall be made through electronic mode to the members who have updated their bank account details. Dividend warrants / demand drafts will be dispatched to the registered address of the members who have not updated their bank account details, after

Payment of dividend will be subject to deduction of tax at source (TDS) at applicable rates. In general, to enable compliance with TDS requirements, Members are requested to complete and / or update their Residential Status, PAN, Category as per the IT Act with their DPs or in case shares are held in physical form with the Registrar by clicking https://www.bigshareonline.com//InvestorRegistration.aspx .For more details, please refer to the Notes to the Notice of AGM.

Manner of registering mandate for receiving Dividend: Members are requested to register / update their complete bank details:

copy of the PAN card and (iii) cancelled cheque leaf.

- (a) with their Depository Participant(s) with whom they maintain their demat accounts, if shares are held in dematerialised or
- (b) with the RTA by clicking on https://www.bigshareonline.com//InvestorRegistration.aspx if shares are held in physical mode, by submitting (i) scanned copy of the signed request letter which shall contain member's name, folio number, bank details (Bank account

Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or e-voting during the AGM.

Company Secretary & Compliance Officer

number, Bank and Branch Name and address, IFSC, MICR details), (ii) self-attested